

M.Phil Physical Education Examination  
Test & Measurement in Physical Education  
May-2017

Time : 3 Hours]

[Max. Marks : 75

प्रश्न-१

(१५)

आपन अने मूल्यांकन वा साधुविक पध्दती स्पष्ट करी ले अंगे विगत समजणी शा.शि. अने वेतन-गमन मां लेनुं गरत्य विस्तारणे समजणी

अथवा

(१५)

उत्तम कसोटी पसंद करपाना होरलो जेगाणी विस्तृत आदिनी आपी समजणी

(१५)

प्रश्न-२

इधिरा लिसरल कसोटी वा इधिरा स्पष्ट करी रावडे स्पष्ट कसोटी नुं योग्य संयासन इंजी-शन ले तांज लेते विस्तारणे समजणी

(१५)

अथवा

वेतन-गमन मां शाश्विक योग्यता अने इधिरा लिसरल योग्यतांनुं गरत्य स-विस्तारणे समजणी (AAHPERD) युव डिपनेस कसोटी नुं संयासन विगत समजणी

प्रश्न-३

गतिशील शरीर मापन कसोटी नो अर्थ अने सिद्धतां पध्दती लेनुं काय होय जेगाणी लया मापना साधक विधी अने टेडनिडो स-विस्तार समजणी

अथवा

(५।१०५)

सूचना

प्रश्न-3

E 565-2

(१५)

श्री २ मिति मापन ना साधने वजावी शरीरना  
क्या लागू मारे क्या साधने ना उपयोग वाय हरे  
ले विस्तार की समन्वय ले अंगेको साधने  
शान्तिपथ रूपर करे

(१५)

प्रश्न-४

रमन डीशलय कसोटीको वजावी लेकी उपयोगीला  
विस्तार की समन्वय र, सल-लेन्ज वाणीजाल डीशलय  
कसोटी सन्विस्तार की समन्वय

(१५)

सूचना

रमन डीशलय कसोटी मापन मारे पायागत टेडनेकी  
कुं कुं सपनावशी ले विस्तार की समन्वय को रसन  
जास्कीर जाल कसोटी समन्वय

प्रश्न-५

(१५)

(डोईपला ले लमा)

- ① गुडींग ना खोरलो, पुकारो वजावी डोईपला अके विरे  
समन्वयी आफो
- ② मेडकी जप अरोजाड कसोटी
- ③ ररन सींग एकी कसोटी
- ④ श्री २ मिति मापन मां लोको वजावी सिद्धां ले  
लफो.

